



## અહીં આગામી સામાન્ય ચૂંટણીમાં તમે મત આપી શકો તેની 3 રીતો છે...

### 1. વોટ-બાય-મેઇલ બેલટ



નોંધણીકૃત મતદારો **VOTE.NJ.GOV** પરની સૂચનાઓને અનુસરીને અથવા તેમના કાઉન્ટી કલર્કનો સંપર્ક કરીને **વોટ-બાય-મેઇલ બેલટ** માટે અરજી કરી શકે છે.

ત્યારપછી, મત આપો અને નીચેમાંથી એક રીતે તમારા બેલટને પરત કરો...

- **મેઇલ:** તમારો વોટ-બાય-મેઇલ બેલટ **નવેમ્બર 8 ના રોજ સાંજના 8:00 વાગ્યા સુધી** પોસ્ટમાર્ક થઈ જવો જરૂરી છે અને તમારા કાઉન્ટી બોર્ડ ઓફ ઈલેક્શન્સ દ્વારા નવેમ્બર 14 ના રોજ અથવા તે પહેલાં પ્રાપ્ત થવો જોઈએ.
- **સુરક્ષિત બેલટ ડ્રોપ બોક્સ:** તમારા વોટ-બાય-મેઇલ બેલટને તમારા કાઉન્ટીના સુરક્ષિત બેલટ ડ્રોપ બોક્સમાં 8 નવેમ્બરના રોજ સાંજના 8:00 સુધીમાં મૂકો. ડ્રોપ બોક્સના સ્થળો **VOTE.NJ.GOV** પર શોધી શકાય છે.
- **બોર્ડ ઓફ ઈલેક્શન ઓફિસ:** તમારા વોટ-બાય-મેઇલ બેલટને તમારા કાઉન્ટીના બોર્ડ ઓફ ઈલેક્શન ઓફિસને 8 નવેમ્બરના રોજ 8:00 વાગ્યા સુધીમાં રૂબરૂમાં પહોંચાડો. કાઉન્ટી ઈલેક્શન અધિકારીઓની સંપર્ક વિગત **VOTE.NJ.GOV** પર મળી શકે છે.

### 2. ઇન-પર્સન વહેલાસર મતદાન



આ વિકલ્પ તમામ રજિસ્ટર્ડ મતદારોને **ચૂંટણીના દિવસ પહેલાના નવ દિવસના સમયગાળા દરમિયાન, મતદાન મશીનનો ઉપયોગ કરીને વ્યક્તિગત રીતે મતદાન કરવા સક્ષમ બનાવે છે.** જ્યારે તમારા શેડ્યુલ માટે સૌથી અનુકૂળ હોય ત્યારે તમે રૂબરૂમાં મત આપવાનું પસંદ કરી શકો છો.

ભલે તમે કાઉન્ટીમાં ગમે ત્યાં રહેતાં હોવ, તમે **તમારી** કાઉન્ટીના નિર્ધારિત કરાયેલા ઇન-પર્સન વહેલાસર મતદાન સ્થળોમાંથી કોઈપણ એક સ્થળ ખાતે તમારું ચોક્કસ બેલટ મતદાન કરી શકો છો. **VOTE.NJ.GOV** ખાતે તમારા કાઉન્ટીના સ્થળો શોધો.

વ્યક્તિગત રીતે પ્રારંભિક મતદાન સ્થાનો **શનિવાર, ઓક્ટોબર 29 થી રવિવાર, નવેમ્બર 6 સુધી** ખુલ્લા રહેશે. **સમય સોમવાર-શનિવાર, સવારના 10:00 - સાંજના 8:00 અને રવીવાર, સવારના 10:00 - સાંજના 6:00 સુધીનો** રહેશે.

કોઈ પૂર્વ નિમણૂકની જરૂર નથી. અપંગતાવાળા મતદારો માટે સગવડ કરવામાં આવશે.

### 3. ચૂંટણીના દિવસે તમારા મતદાન સ્થળ પર



**મતદાનના દિવસે, નવેમ્બર 8ના રોજ** તમારા પોલિંગ સ્થળ પર સવારે 6:00 થી સાંજના 8:00 સુધી રૂબરૂમાં મત આપો. અપંગતાવાળા મતદારો માટે સગવડ કરવામાં આવશે.

પોલિંગ સ્થળોના પાના પર સૂચિબદ્ધ તમારા પોલિંગ સ્થાન માટે **VOTE.NJ.GOV** પર જાઓ.

**નોંધ:** વોટ-બાય-મેઇલ બેલટ્સને તમારા વહેલા મતદાન સ્થળ પર અથવા મતદાન સ્થળ પર પરત કરી શકાતા નથી.



ગવર્નર Phil Murphy  
સેક્રેટરી ઓફ સ્ટેટ Tahesha Way

1-877-NJ-VOTER (1-877-658-6837)  
Vote.NJ.Gov